

ڪچي جو سير

ڪيا جي حاصلات تحرير جي حاصل مطلب، لفظي، فڪري ۽ فني خوبين کان آگاهه ٿي سگهي. لفظن جي معني لکي جملن ۾ ڪر آئي سگهي. تحيل جي اذام وسيلي پنج سو کان وڌيڪ لفظن تي آذاريل مضمون تخليقي سطح تي عمدن مثالان، منظر نگاري، مڪالهي نگاري ۽ شعرن وسيلي سينگاري پيش ڪري سگهي. محاورن جي سمجھائي لکي سگهي. سڌ سماء جي ذريعن، تيڪنالاجي، ڪمپيوٽر کي سنديء ۾ استعمال ڪري سگهي. بحث مباحثن ۽ مذاڪرن ۾ حصو وٺي سگهي.

دریاهم جي پنهنجون ڪپن واريء زمين کي 'ڪچو' چئبو آهي ۽ اتي جي رهاڪن کي 'ڪچي جا ماڻهو' ڪري سدبو آهي. ڪچي ۾ گهانا جهنگ ۽ پيلا آهن، جن ۾ پير، باهڻ ۽ ڪانهن ڪثرت سان هوندا آهن. زمين سڀك واري ٿيندي آهي، جنهن تي چېر هميشه چاول هوندي آهي. ڪانهن کي ڪچي جي ماڻهن جون پياريون ۽ دل گهريون مينهون ۽ وچون خوشيء وچان دل پري ڪائينديون آهن. ڪانهن ڪائڻ ڪري آهي کير ۽ مڪڻ جام ڏينديون آهن. سانوڻ ۾ سجو ڪچو پاڻي هوندو آهي. وري سره جو، جڏهن پاڻيء جي مُند ختم ٿيندي آهي، تڏهن ڪچو به سکندو آهي. سانوڻ ۾ اتي جا ڀاڳيا پنهنجون مينهون، ڏاند، ڳئون هڙئي پکي تي ڪي ايمنا آهن، جتي پاڻي ڪونهوندو آهي. ڀاڳين کي پنهنجي مال جي سُک جو گهڻو خيال هوندو آهي، سندن مال خوش ته پاڻ به خوش.

ڪچي ۾ دریاهم جي پرسان تمام سنا ۽ مو هيئندڙ نظارا ٿيندا آهن. جن کي ڏسيو دل گهري ته ساري ڄمار انهن کي ڏسندی پوري ڪجي. باهڻ ۽ پيرن جا ودا ودا وڻ، چنار جي درختن وانگر، ڪپن سان هوندا آهن، تن جي هيئان ڀاڳين جون مينهون ۽ وچون ڪيرن ۾ چرنديون نظر ايمنديون آهن. انهن جي چتن جو آواز ساري جهنگ ۾ ٻڌي ڏنارن جون دليون ٻهڪنديون آهن. ڀاڳيا، جن کي ڏنار به چئبو آهي، سي دریاهم جي ڪپن تي چېر جي سبزي تي وينا پنهنجين مينهن جي تعريف ۾ يا مارن جا راڳ پيا ڳائيندا آهن. هنن جون دليون، غم گوندر کان بي خبر، هميشه خوشيء ۾ هونديون آهن. دریاهم جي پيتارن تي ڪڙمي ڪترن، جا سرنه جي نموني ٿيندي آهي، پوکيندا آهن. جنهن وقت اها گل ڪندي آهي، تنهن وقت جادڻي نظر ڪري

تادી કાઠી કાઠ નેર એન્ડિ આહી. સોિન જ્રિબ પોકિલ હોન્ડા આહે. ઓરી હોતી જા અં જી ખુશ્બુ એચી, સા તે દમાગ હ નશો પીડા ક્યો ચ્છી. જન્હેન વ્યતી જાડી કાડી ગ્લ કરી બીહન્ડિ આહી, તન્હેન વ્યતી દ્રિયાહ કનોવ જી ન્મોની સ્નેન્ગારિલ નેર એન્ડો આહી.

ક્યુ જી માથેન જા ગ્હેર બાહેન ય કાન્હેન જા ન્હીલ હોન્ડા આહે. કન કન હ તે બન્ગલન કાન બે વ્ધીક વિન્હેન હ મ્રો એન્ડો આહી, ય સન્દન રહાકુ બે પન્હન્જન ય અન્હેન ક્કાન જ્હેપ્રિન ક્યી બન્ગલન ય મહલન ય માર્ઝિન કાન વ્ધીક સ્મજેન્દા આહે, ય અન્હેન હ ખ્ષ્ઓશી ય મ્રે સાન ગ્ડારિન્ડા આહે. ચ્છ ય પ્ત્યિન જીક્કી કાન્હેન સાન ન્હીલ હોન્ડિયોન આહે, સ્યી ટમાર પ્ક્યુન ય જ્તાદાર ત્યિન્ડિયોન આહે. અન્હેન ક્યી મ્યિન્હેન વાં જો ખ્ત્રો મુર ન આહે, ગ્હેરન કાન વ્ધીક હો પન્હન્જન મ્યિન્હેન જા મન્હે, જન ક્યી વાં બે સ્યિન્ડા આહે, સ્ના, મ્સ્બ્રોટ, ય ક્ષાદા નાહિન્દા આહે. હેન ક્યી સાહે કાન બે વ્ધીક સન્દન મ્યિન્હેન ય મન્હે પ્પિયા હોન્ડા આહે. ક્યુ હ ગ્રિબ ક્યી બે બે ચાર મ્યિન્હેન પ્રસ્તુર હોન્ડિયોન, ન તે બદ્ભુત સ્ય્ડ્યો વિન્દો. ઓડ પાંક્યિન ક્યી સો ડ્યિડ કન મ્યિન્હેન ય ક્કૉન ત્યિન્ડિયોન આહે.

ક્યુ હ ડેન બારહેન ગ્હેરન જો ક્કુન્ન્નો ત્યિન્દો આહી, જો અન્હેન જી વ્ધી પાંક્યિ જી નાલી જી પન્નિયાન સ્ન્ડ્બો આહી. જી કન્હેન ર્ઝ્મિન્દાર જો હોન્ડો આહી, તે ફલાટી જી, 'ક્યિટી' કરી ચ્છ્યબો આહી. ક્કુન્ન્ની જા રસ્તા ટમાર સ્વ્રૂંશા, ચારન જી ન્મોની ત્યિન્દા આહે, જી ગ્હેરન જી અગ્ન્ન હ્રોજિ કન્નદા આહે. ચારન જી બન્હી પાસી પાંન પીલ હોન્ડો આહી, વચ્ચે માન રસ્તો ત્યિન્દો આહી. પાંન પાંક્યિન ક્યી સાન્નું જો દુન્હેન જી સ્ક્રુ હ એન્ડો આહી, સ્યિયારી જો કન્નો કન્ના વિન્દા આહે. હ્ર ક્હેર ય વાંઝી જી ચ્છ્યારી કન્નદા જો પ્યિયો હોન્ડો આહી, જો સ્ટ્રેટ એ ફૂટ ઓડ ત્યિન્દો આહી ય 'દ્રાંજન્હેન ક્યી ક્ક્લી' કરી સ્યિન્દા આહે, સ્વો રાત જો દિન્ગ સાન બંદ કરી ચ્છ્યિન્દા આહે.

(ગલ્હીયન ક્કુન્નું જોન, તાન વર્તલ)

مشق

(الف) هينين سوالن جا جواب ڏيو:

- ڪچو چاکي چئبو آهي؟ اتان جا نظارا ڪيئن ٿيندا آهن؟ 1
 ڪيٽي چا کي چئبو آهي؟ 2
 ڪچي جي ماڻهن جي رهڻي ڪھڻي بابت او هان چا تا جاڻو؟ 3
 سانوڻ جي مُند ۾ ڪچو ڪيئن نظر ايندو آهي؟ 4

(ب) هينين لفظن جي معني لکي جملن ۾ ڪر آئيو:

ڇڙو گوندر پاڳيو دنگر پيهو

(ج) هينين جا ضد لکو:

ڪچو بدخت ڪشادا مضبوط خوشی

(د) لفظن جو اهڙزو فقرو يا اهڙي فعلي صورت، جيڪا سڌي معني رکي
ته ان کي محاورو چئبوآهي. هينين محاورن جي سمجھائي ڏيو:

- * آئي ويل ڪم اچڻ * ايرندي تاء ڪرڻ
- * ڪير ڪند ٿيڻ * پاڳ گلڻ

(ه) زمان ماضي متشكى:

‘مون لکيو هوندو’ اهڙو جملو آهي، جيڪو زمان ماضيء واري
ڳالهه کي ‘مشڪوك صورت’ ۾ بيان ڪري ٿو. هيٺ، مختصرا
زمان ماضيء جي اهم صورتن جو وچور ڏجي ٿو:

- * زمان ماضي: مون لکيو.
- * زمان ماضي استمراري: مون لکيو پئي.
- * زمان ماضي قريب: مون لکيو آهي.
- * زمان ماضي بعيد: مون لکيو هو.
- * زمان ماضي متشكى: مون لکيو هوندو.

‘زمان ماضي متشکي’ ۾ فعل جي ماضي صورت ۽ مددی فعل ‘هوندو/ هوندي/ هوندا/ هونديون’ ڪم آندل هوندو آهي.
توهان پڙهيل سبق مان ‘زمان ماضي متشکي’ جا جملा چوندي
لكو ۽ انهن جھڙو هڪ پنهنجو جملو لکو.

(و) ‘ڪچي جي سير’ بابت مضمون لکو:

سرگرمي:

ڪچو، ماحوليات لاءِ چوضوري آهي؟ اوهان ڪلاس ۾ انهيءَ موضوع تي بحث
مباحشو ڪرايو.

استاد لاءِ هدایت:

شاگردن کي انترنيت ذريعي ڪچي جي مختصر دستاويزي فلم
ڏيکاري، ان بابت وڌيڪ ڄاڻ ڏئي.